



Freshtrop Fruits Limited

Registered Office : A - 603, Shapath IV, S. G. Road, Ahmedabad-380 015, Gujarat, INDIA.
Tel. : +91-79-40307050 - 59 www.freshtrop.com info@freshtrop.com
CIN : L15400GJ1992PLC018365

Date: June 01, 2023

To,
BSE LIMITED
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai - 400001

SUB: NEWSPAPER ADVERTISEMENT FOR PUBLICATION OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH 2023.

REF: FRESHTROP FRUITS LIMITED - SECURITY CODE - 530077 - SECURITY ID - FRSHTRP

Dear Sir / Madam,

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith extracts of the Audited Financial Results for the year ended March 31, 2023, approved by the Board of Directors of the Company at their meeting held on Tuesday, 30th day of May 2023 published in following newspapers.

1. Business Standard, Ahmedabad (English Language)
2. Jai Hind, Gujrati

This is for your information and records.

Thanking You,

Yours faithfully,

FOR, FRESHTROP FRUITS LIMITED

Ashok
Vishindas
Motiani

Digitally signed by
Ashok Vishindas
Motiani
Date: 2023.06.01
15:08:27 +05'30'

ASHOK MOTIANI
CHAIRMAN & MANAGING DIRECTOR
DIN: 00124470

HEG LIMITED
 Regd. Off.: Mandideep (Near Bhopal), Distt. Raichur-62046, Madhya Pradesh,
 Tel: 07480-233524, 233525; Fax: 07480-233522;
 Corp. Off.: Bhiwara Towers, A-12, Sector-1, Noida-201301 (U.P.);
 Phone: 0120-4390300 (EPABX), Fax: 0120-4277841; CIN: L23109MP1972PLC00280
 E-mail: heg.investor@njbhiwara.com; Website: www.hegtd.com

NOTICE is hereby given that the following Share Certificate(s) have been reported lost/ misplaced. Any person who has any claim in respect of any of these shares should communicate the same at Company's Registered Office/Corporate Office within 15 days from the date of this Notice. The Company will start the process to issue duplicate Share Certificate(s) / Letter(s) of Confirmation, wherever applicable, in case no objection is received.

S.N.	F. No.	Name of Shareholder(s)	S/C No.	Distinctive Nos.	Shares
1	22281	AMIT MAKHANA	98899	11554005-11554042	38
			272530-272534	25720289-25720376	88
2	24442	BEENA PATEL	77226	10486241-10486290	50
			278734	27184003-27184052	50
3	34723	ARUN KEJRIWAL	126131	16959166-16959215	50
			291064	28678555-28678604	50
4	22721	INDU KASBEKAR	83400	10794941-10794990	50
5	81004	PRITAM SINGH SATINDER JUNEJA	257907	25486624-25486648	25
6	66734	BINOD KUMAR SETHI SOMA DEVI SETHI	331610	30702691-30702740	50
7	15617	S S ANAND	255485-255489	25445091-25445178	88
8	19287	SUNANDA M PANSHIKAR MANOHAR A PANSHIKAR	79961-79962	10622991-10623090	100
			98848-98849	11478472-11478547	76
			265822-265826	25609658-25609653	176
9	61750	SUNANDA PANSHIKAR	160218	18684516-18684565	50
			325289	30388543-30388592	50
10	64016	V P GHULIANI JASWANT RAM	328179	30532916-30532965	50
11	64326	RAJENDRA RANG YADAV	163417-163419	18825466-18825615	150
			328508-328510	30549366-30549415	150

Date: 31.05.2023
 Place: Noida
 for HEG LIMITED
 (Vivek Chauchary)
 Company Secretary (A-13263)

MAHESHWARI LOGISTICS LIMITED
 CIN: L20232G12006PLC049224
 Address: MLL House, Shed No. A2-3/2, Opp. UPL, 1st Phase, GIDC, Vapi-396195,
 Phone No. 0260-2431024, Email: info@mjlpl.biz, Website: www.mjlpl.biz

Extract of Standalone and Consolidated Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2023
 (Amount in Lakhs Except EPS)

Sr. No.	Particulars	Standalone			Consolidated		
		Quarter Ended		Year Ended	Quarter Ended		Year Ended
		31.03.2023	31.12.2022	31.03.2023	31.03.2023	31.12.2022	31.03.2023
		Audited	Unaudited	Audited	Audited	Unaudited	Audited
1	Total Income from Operations	27,496.23	30,556.28	1,14,436.11	27,851.78	30,837.09	1,14,904.79
2	Earnings before Interest Depreciation and Tax (EBIDTA)	1,226.68	1,354.83	5,245.39	1,235.23	1,360.87	5,257.15
3	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	383.54	431.05	1,811.80	394.36	434.50	1,823.22
4	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary Items)	383.54	431.05	1,811.80	394.36	434.50	1,823.22
5	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	362.95	273.52	1,366.96	346.02	270.49	1,348.20
6	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	348.96	276.32	1,363.94	332.04	273.29	1,345.19
7	Equity Share Capital (Face Value of Rs. 10/- per Share)	2,959.72	2,959.72	2,959.72	2,959.72	2,959.72	2,959.72
8	Earnings per equity share						
	(a) Basic	1.23	0.92	4.62	1.17	0.91	4.56
	(b) Diluted	1.23	0.92	4.62	1.17	0.91	4.56

Notes:
 1. The above Audited Financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meeting held on 30th May, 2023.
 2. The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.nseindia.com and the Company's website at www.mjlpl.biz.
 3. Figures have been regrouped wherever necessary.

On behalf of the Board of Directors of MAHESHWARI LOGISTICS LIMITED
 Sd/-
 Vinay Maheshwari
 Chairman & Wholtime Director
 DIN: 01680099
 Place: Vapi
 Date: 30.05.2023

MACHINO PLASTICS LTD.
 Regd. Office: Plot # 3, Maruti Joint Venture Complex, Delhi Gurugram Road, Gurugram, Haryana - 122015
 Phone: 0124-2341216, 2340806, Fax: 0124-2340892, E-mail: admin@machino.com, Website: www.machino.com
 CIN: L25209HR2003PLC035034

Extract of Statement of Unaudited/Audited Financial Results for the Quarter / Year Ended 31st March 2023
 (Rs. in Lakhs)

Sl. No.	Particulars	Quarter ended		Year ended	
		31-Mar-23 (Unaudited)	31-Mar-23 (Audited)	31-Mar-22 (Unaudited)	31-Mar-22 (Audited)
1	Total Revenue from Operations (net)	6,069.40	33,128.77	7,865.66	
2	Net Profit / (Loss) before tax	11.19	214.15	24.20	
3	Net Profit / (Loss) after taxes & exceptional items	16.17	199.55	50.69	
4	Total Comprehensive Income (after tax)	42.52	183.99	38.77	
5	Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each)	613.68	613.68	613.68	
6	Reserves excluding revaluation reserves as per balance sheet of previous accounting year*	--	3,503.03	--	
7	Earning per share (EPS) before Exceptional items				
	a) Basic EPS (Rs.)	0.30	2.60	0.83	
	b) Diluted EPS (Rs.)	0.30	2.60	0.83	
8	Earning per share (EPS) after Exceptional items				
	a) Basic EPS (Rs.)	0.30	2.60	0.83	
	b) Diluted EPS (Rs.)	0.30	2.60	0.83	

*Reserve excluding revaluation reserves for the period ended as on 31st March 2022 was Rs. 3,318.12 lakhs.

NOTES:
 1. The above unaudited/audited financial results for the quarter and year ended 31st March, 2023 were reviewed by the audit committee and were taken on record by the Board of Directors in their meeting held on 30th May, 2023. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.
 2. The above is an extract of the detailed format of unaudited/audited results for the quarter and year ended 31st March, 2023 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited results for the quarter and audited results for the year ended 31st March, 2023 are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company's website (www.machino.com).

By Order of the Board For MACHINO PLASTICS LIMITED
 Sd/-
 Aditya Jindal
 Chairman cum Managing Director
 Place: Gurugram
 Date: 30th May, 2023

MPS INFOTECNICS LIMITED
 Regd. Off: 703, Anurachal Building, 19 Barakhamba Road, New Delhi-110001
 CIN: L30007DL1985PLC131910, Ph: 011-43571044, Fax: 011-43571047; Email: info@mpsinfotec.com

Extract of Audited Financial Results (Consolidated) for the Quarter and Year Ended March 31, 2023
 (INR In Lacs)

S. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31-Mar-23		31-Mar-22	
		Audited	Un-audited	Audited	Audited
1	Total income from operations (net)	114.70	12.77	18.40	153.99
2	Net Profit / (Loss) from ordinary activities before tax	(131.03)	(119.75)	(133.40)	(504.50)
3	Net Profit / (Loss) from ordinary activities after tax	(113.63)	(104.18)	(124.13)	(440.38)
4	Total Comprehensive Income for the Period (Net of Taxes)	(123.98)	(89.86)	(94.48)	(374.08)
4	Equity Share Capital (Face Value Rs.1/- per share)	37744.37	37744.37	37744.37	37744.37
5	Reserves excluding Revaluation reserves (i.e. Other equity)				5726.98
6	Earning Per Share (Basic)	(0.003)	(0.003)	(0.003)	(0.012)
7	Earning Per Share (Diluted)	(0.003)	(0.003)	(0.003)	(0.012)

Notes:
 1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchanges websites www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.mpsinfotec.com.
 2. The key standalone financial information are as under:

Particulars	Quarter Ended		Year Ended	
	31-Mar-23		31-Mar-22	
	Audited	Un-audited	Audited	Audited
Total Income	114.70	12.77	18.40	153.99
Profit before tax	(131.03)	(119.75)	(133.40)	(504.50)
Profit after tax	(113.63)	(104.18)	(124.13)	(440.38)

3. The above results have been reviewed and recommended to the Board of Directors by the Audit Committee and subsequently approved by the Board of Directors at its meeting held on May 30, 2023.

For MPS Infotecnics Limited
 Sd/-
 Peeyush Kumar Aggarwal
 Chairman
 DIN: 00090423
 Place: New Delhi
 Date: 30/05/2023

DBO
DHAMPUR BIO ORGANICS LIMITED
 Regd office: Sugar Mill Compound, Village Asmol, Sambhal, Moradabad, UP-244304
 CIN: L15100UP2020PLC136939, Tel: +91-7302318313,
 E-mail: investors@dhampur.com, Website: www.dhampur.com,
 PUBLIC NOTICE OF CONVENING 3RD ANNUAL GENERAL MEETING THROUGH VCOAVM

Notice is hereby given that the 3rd Annual General Meeting ("AGM") of the members of Dhampur Bio Organics Limited ("the Company") will be convened on Friday, June 30, 2023 at 04:00 P.M. (IST) through Video Conferencing ("VC")/ Other Audio Visual Means ("OAVM") as per the provisions of the Companies Act, 2013 and the Rules made thereunder, read with General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020, 02/2021 dated Jan 13, 2021, 02/2022 dated May 5, 2022, and 10/2022 dated December 28, 2022 issued by Ministry of Corporate Affairs ("MCA"), and Securities and Exchange Board of India ("SEBI") Circular SEBI/HO/CFD/PoD-ZP/CIR/2023/4 dated January 5, 2023 without the physical presence of the members at a common venue. The deemed venue for the 3rd AGM shall be the Registered office of the Company.

The VCOAVM facility for the AGM shall be provided by National Securities Depository Limited (NSDL) to transact the business set out in the Notice convening the AGM. The attendance through VCOAVM will be counted for the purpose of reckoning the quorum for the AGM.

In compliance with the above-mentioned circulars, electronic copies of the Notice convening the AGM along with Explanatory Statement and the Annual Report for the Financial Year 2022-23 will be sent by e-mail to those members who have registered their email IDs with the Company/ M/s Alankit Assignments Limited ("RTA") and Depository Participant(s) ("DPs"). The requirement of sending physical copies of the annual report has been dispensed with vide abovementioned MCA and SEBI Circular(s). However, the physical copies of the Notice of 3rd AGM along with the Annual Report shall be sent to the members who request the same at investors@dhampur.com. The Notice of the AGM and Annual Report will also be available on the website of the Company i.e., www.dhampur.com, websites of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

Manner of registration of e-mail address
 For the limited purpose of sending the Notice of the AGM and Annual Report for the FY 2022-23 through e-mail to those members holding shares in dematerialized form and whose e-mail address is not registered with their Depository Participant, such members may also temporarily get their e-mail id registered by providing the Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), name, client master or copy of Consolidated Account Statement, PAN Card (Self Attested Copy), Aadhar Card (Self Attested Copy) to Company at investors@dhampur.com / RTA e-mail id at rta@alankit.com or visit the link https://mailup.dhampur.com.

It is clarified that for permanent registration of e-mail address, the Members are requested to register the same with their respective Depository Participant.

Manner of casting vote(s)
 The members will have an opportunity to cast their vote(s) on the businesses as set forth in the notice of the AGM through remote e-voting facility. The facility for e-voting will also be made available during the AGM to those members who have not casted their vote(s) through remote e-voting. The detailed procedure for e-voting before as well as during the AGM and attending the AGM through VCOAVM will be provided in Notice of the AGM.

Record Date for payment of final dividend
 The Company has fixed Friday, June 23, 2023 as the Record Date for determining the eligibility of members to receive final dividend. The dividend of Rs. 3.50/- per equity shares of face value Rs. 10 each has been recommended by the Board of Directors, at their meeting held on April 25, 2023, for the year ended March 31, 2023, subject to the approval of shareholders at the AGM. The dividend, if approved will be paid within the stipulated period of 30 days from its declaration through electronic mode to those members whose updated bank account details are available, for members whose bank account details are not updated, dividend warrants / demand drafts will be sent to their registered address. To avoid delay in receiving dividend, members are requested to register / update their bank account details. Members may send their requests for change / updation of address, bank account details, email address, nominations, etc. to their respective Depository Participant.

The Notice is being issued for the information and benefit of all the members of the Company in compliance with the applicable circulars of MCA and SEBI.

For Dhampur Bio Organics Limited
 Sd/-
 Ashu Rawat
 Company Secretary
 Place: New Delhi
 Date: May 31, 2023

ANG Lifesciences India Limited
 Reg: SCO-113 Darbara Complex Ranjit Avenue B Block Amritsar -143001
 CIN: L24230PB2006PLC030341 | Website: www.anglifesciences.com |
 cs@anglifesciences.com | Tel No : 0183-5133473

Extract of Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2023

Particulars	STANDALONE			CONSOLIDATED		
	Quarter ended (In lakhs)		Year ended (In lakhs)	Quarter ended (In lakhs)		Year ended (In lakhs)
	31.03.2023	31.12.2022	31.03.2022	31.03.2023	31.03.2022	
Total Income from operations	4107.98	4549.21	9649.32	21684.79	34962.09	
Profit before exceptional items and tax	(632.79)	(229.44)	686.54	206.92	5306.36	
Net profit for the period after tax	(503.03)	(159.57)	528.19	(66.22)	3971.30	
Total comprehensive income for the year	(516.36)	(159.75)	537.54	5.41	3992.23	
Paid-up equity share capital (Face value Rs. 10/- per share)	1305.83	1305.83	1036.66	1305.83	1036.66	
Other Equity				7247.69	7311.45	
Earnings per equity share (of Rs. 10/- each)						
a) Basic	(3.95)	(1.22)	5.19	0.04	38.51	
b) Diluted	(3.95)	(1.22)	5.19	0.04	38.51	

NOTES:
 1. The standalone and consolidated financial results for the quarter and year ended 31st March, 2023 have been reviewed by the Audit Committee and approved by the company's Board of Directors in their respective meetings held
 2. These financial results are available on the website of the Company at www.anglifesciences.com and are also available on the website of Bombay Stock Exchange at www.bseindia.com.

For ANG Lifesciences India Limited
 Sd/-
 Rajesh Gupta
 Managing Director
 DIN: 01423407
 Place: Amritsar
 Date: 1st June, 2023

FRESHTROP FRUITS LIMITED
 Reg Office: A 603, Shapath IV, S. G. Road, Ahmedabad - 380015
 Tel: 079 40307050 | www.freshtrop.com | CIN: L15400GJ1992PLC018365

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER / YEAR ENDED 31ST MARCH, 2023
 (Rs. in Lakhs)

Particulars	Quarter ended 31 March 2023 (Audited)	Quarter ended 31 December 2022 (Un-Audited)	Quarter ended 31 March 2022 (Audited)	Year ended 31 March 2023 (Audited)	Year ended 31 March 2022 (Audited)
	Total Income from operations (net)	7,745.75	3,397.21	6,506.67	24,726.79
Net Profit for the period (before tax and exceptional items)	959.63	293.61	455.03	1,096.91	1,032.07
Net Profit for the period before tax (after exceptional items)	959.63	293.61	455.03	1,096.91	1,032.07
Net Profit for the period after tax (after exceptional items)	687.75	207.95	310.04	846.35	735.63
Total Comprehensive Income for the period	(11.46)	13.94	7.63	4.58	17.52
Profit/Loss for the period after comprehensive income	676.29	221.89	317.67	850.93	753.16
Equity Share Capital	989.49	1,068.80	1,068.80	989.49	1,068.80
Earning Per Share (Of Rs. 10 each) (after extraordinary items)					
Basic:	6.95	1.95	2.90	8.55	6.88
Diluted:	6.95	1.95	2.90	8.55	6.88

Capital Employed has not been identified with any of the reportable segments, as the assets used in the Company's business and the liabilities contracted are used inter changeably between segments.

NOTE: (1) The above results were reviewed by the audit Committee and were approved and taken on record by the Board of Directors in their meeting held on May 30, 2023 (2) Revenue From Operations includes Export Incentives. (3) The Company has identified following segments as reportable segment in accordance with Ind AS-108 issued by the ICAI. Segment wise details are given to the extent possible. a) Fresh Fruits b) Food Processing (4) Previous Year's figures have been regrouped, reclassified wherever considered necessary.

Date: 30-05-2023
 Place: Ahmedabad
 For & on behalf of the Board of Directors
 Ashok Motiani | Managing Director

BAJAJ HEALTHCARE LIMITED
 Registered Office: 602-606, Bhoomi Velocity Infotech Park, Plot No. 8-39A, B-39 A/L/Rd No.23, Wagle ind. Estate Thane West, Thane-400 604
 CIN: I99999MH1993PLC02892
 Tel: 022-6617 7400; Fax: 022-6617 7458
 Website: www.bajajhealth.com; Email Id: investors@bajajhealth.com

EXTRACTS OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2023
 (Amount in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31/03/2023 (Audited)	31/03/2022 (Audited)	31/03/2023 (Audited)	31/03/2022 (Audited)
1.	Total Income from Operations	15,844.45	17,571.36	67,329.20	67,988.98
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	500.22	1,692.89	5,821.63	8,968.46
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	500.22	1,692.89	5,821.63	8,968.46
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	359.24	1,747.20	4,302.43	7,138.59
5.	Total Comprehensive Income	391.17	1,754.10	4,334.36	7,145.49
6.	Equity Share Capital	1,379.82	1,379.92	1,379.92	1,379.92
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	31,468.63
8.	Earnings Per Share (of Rs. 05/- each) (for continuing and discontinued operations) - 1. Basic: (per shares Rs.) 2. Diluted: (per shares Rs.)	1.30 1.30	6.33 6.33	15.59 15.59	25.87 25.87

Notes:
 1. The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in their respective meeting held on 30th May, 2023.
 2. The Statutory Auditors of the Company has issued Audit Report as required under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 with un-modified opinion.
 3. The figures of the previous period have been regrouped whenever necessary.
 4. The above is an extract of the detailed Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The detailed Audited Financial Results are available on the Stock Exchanges' websites i.e. www.bseindia.com/www.nseindia.com and also available on the Company's website i.e. www.bajajhealth.com.

FOR BAJAJ HEALTHCARE LIMITED
 Sd/-
 Akash Keshari
 Company Secretary
 Place: Thane
 Date: 31/05/2023

KVB Karur Vysya Bank
 Smart way to bank

THE KARUR VYSYA BANK LIMITED
 Registered & Central Office, No. 20, Erode Road, Vaidivel Nagar, L.N.S., Karur - 639002 [CIN No: L65110TN1916PLC001295]
 [e-Mail: kvb_sig@kvbmail.com] [Website: www.kvb.co.in]
 [Tel

હિરો ઈલેક્ટ્રીક, ઓલા, ઓડીનાવા અને ગ્રીવ્સ કોટનએ હેરાફેરી કરી

સબસીડી ગોટાળો: ઈ-સ્કુટર કંપનીઓ પાસેથી જંગી રકમ વસૂલવા નોટીસ

નવી દિલ્લી તા.૩૧ ઈ-પાદક કંપનીઓ દ્વારા સરકારી સબસીડી મેળવવા જે હેરાફેરી કરાતી હોવાની જાણ થતાં ઈ-સ્કુટર કંપનીઓએ સરકારી સબસીડી રોકી છે જેમાં હિરો ઈલેક્ટ્રીક, ઓડીનાવા, ઓલા તથા ગ્રીવ્સ સ્કોટનના નામ બહાર આવ્યા છે. આ કંપનીઓએ તેમના ઈ-સ્કુટરના ઉત્પાદનોમાં સ્વદેશી ટેકનોલોજી અને સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરવાનો લનો પરંતુ તેઓએ ઈલેક્ટ્રીક મોટર કન્ટ્રોલર અને અન્ય ઈલેક્ટ્રીક ચાર્જર વિદેશી આયાત કરીને તેને સ્થાનિક ઉત્પાદક તરીકે સ્થાપવા કોશીલ કરી હતી જેમાં હવે કેન્દ્ર સરકારે ઓડીનાવા ઓટોટેક

પાસેથી રૂ.૧૧૬ કરોડ, હિરો ઈલેક્ટ્રીક પાસેથી રૂ.૧૩૩ કરોડ, ઓલા ઈલેક્ટ્રીક પાસેથી રૂ.૧૩૦ કરોડની રીકવરીની નોટીસ ફટકારી છે અને ઓલાએ પોતાની 'ગુલ' સ્વીકારીને આ રકમ પરત આપવા તૈયારી બતાવી છે. ઓટોમોટીવ

આચરતા સબસીડી ઘટાડી દીધી છે અને રીકવરી નોટીસ આપવામાં આવી છે.

મનીષ સીસોદીયાએ રૂ.૨.૨ કરોડની લાંચ લીધી હતી: ચાર્જશીટમાં દાવો

નવી દિલ્લી, તા. ૩૧ ઈલ્લીના પૂર્વ ઉપમુખ મંત્રી મનીષ સીસોદીયાની મુકદ્દમી વધી રહી છે. પાટનગરના શરાબ પોલીસી કાંડમાં એક વ્યાપારી અમિત અરોરાને ફાયદો કરાવવા માટે મનીષ સીસોદીયાએ રૂ. ૨.૨ કરોડની લાંચ લીધી હોવાનો દાવો એન્ફોર્સમેન્ટ વિભાગે ચાર્જશીટમાં કર્યો છે. હાલ સીસોદીયા બાંબા સમયથી જેલમાં છે અને લાર્ડકોર્ટ સુધી તેના જામીન નકારાયા છે હવે તા.૧ જુનથી આ ચાર્જશીટ ઉપર અદાલતમાં સુનાવણી શરૂ થશે જેમાં જણાવ્યું છે કે સીસોદીયાના નષ્ટક

ગણાતા દિનેશ અરોરા અને શરાબના મોટા વ્યાપારી અમિત અરોરાએ સોદો કર્યો હતો અને તેમાં સીસોદીયાએ આજ્ઞી સીસોદીયા સામે ટ્રાયલ કોર્ટમાં સુનાવણી: 'આપ'ના નેતા પાસેથી કોઈ રીકવરી થઈ નથી રૂ.૨.૨ કરોડની લાંચ અપાઈ હતી. જોકે હજુ સુધી ઈલેક્ટ્રીક કોઈ નાણાકીય રીકવરી કરી નથી. પરંતુ હવે દિલ્લીની ટ્રાયલ કોર્ટ કરી રીતે સીસોદીયા સામેના આરોપને લે છે તેના પર સીની નજર છે. ઈલેક્ટ્રીક ચાર્જશીટની સાથે અમિત અરોરાની કંપનીના ખાતાની માલિકી મોકલી આપી છે જેમાં કેસ વ્યવહાર દર્શાવવા છે. ઉપરાંત એ પણ દર્શાવ્યું છે કે સીસોદીયાને આપવા માટે મોટી રકમ અનામત રાખવામાં આવી હતી અને આ રકમ બાદમાં ચુકવણી થઈ હતી. જોકે તેમાં રકમ કરી રીતે અપાઈ અને ક્યાં જમા થઈ તે દર્શાવવામાં આવ્યું નથી.

મહારાષ્ટ્રમાં ખેડૂતો માત્ર એક રૂપિયામાં પાક વીમો લઈ શકશે મુંબઈ, તા. ૩૧ મહારાષ્ટ્ર સરકારે રાજ્યના ખેડૂતો માટે મંગળવારે મહત્વની જાહેરાત કરી છે. નવો શેતકરી મહાસન્માન નિધિ યોજનાને કેબિનેટની બેઠકમાં લીલી ઝંડી બતાવવામાં આવી છે. મહારાષ્ટ્રના ખેડૂતો હવે પાક વીમો ૧ રૂપિયામાં લઈ શકશે. ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ નહીં ચુકવવું પર કારણકે તેમના ભાગનું ૨ ટકા પ્રીમિયમ રાજ્ય સરકાર ચુકવી દેશે. માર્ચ મહિનામાં રાજ્યના અજેટ વખતે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો, જેને મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. વીમા કંપનીઓના નફાને નિયંત્રિત કરતાં મોડલને પણ કેબિનેટ મંજૂરી આપી છે.

કેરળ હાઈકોર્ટનો ચુકાદો એજ્યુકેશન લોન માટે સિબિલ ઓછો હોય છતાં ના ન પારી શકાય થિરવનંતપુરમ, તા. ૩૧ કેરળ હાઈકોર્ટે તેની એક કેસ પર સુનાવણી કરતાં કહ્યું કે સિબિલસ્કોર ઓછો હોય તેમ છતાં કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન આપવા માટે બેંક ના ન પારી શકે. બેંકોને ફટકાર લગાવતા જસ્ટિસ પી.વી. કુન્દીકુમ્બને શિક્ષણ લોન માટેની અરજી પર વિચાર કરતી વખતે બેંકોને માનવીય દૃષ્ટિકોણ અપનાવવા આગ્રહ કર્યો હતો. એક અહેવાલ અનુસાર હાઈકોર્ટે વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે વિદ્યાર્થી ભવિષ્યના રાષ્ટ્રનિર્માતા છે. તેમણે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરવાનું છે. ફક્ત એટલા માટે કે એક વિદ્યાર્થીનો સિબિલસ્કોર ઓછો છે અને તેણે એજ્યુકેશન લોન માટે અરજી કરી છે, માર્ગ માનવું છે કે આવા વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોન અરજીને બેંક દ્વારા નકારવામાં ન આવે. આ મામલે અરજદાર જે એક વિદ્યાર્થી છે તેણે બે લોન લીધી હતી જેમાં એક લોનના ૧૬૬૬૦ રૂ. ચુકવવાના બાકી હતા. બેંકે બીજી લોનને એનપીએ કરી દીધી હતી. આ કારણે અરજદારનો સિબિલસ્કોર નબળો પડી ગયો હતો. અરજદારના વકીલોએ કોર્ટમાં કહ્યું કે જો તેને લોન નહીં મળે તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે. અરજદાર વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલને એક મટીને શનલ કંપનીથી નોકરીની ઓફર મળી છે અને તે થોડા સમય બાદ સંપૂર્ણ લોન ચુકવવામાં સક્ષમ મળી જશે. ત્યારબાદ હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અરજદારની તરફમાં આપ્યો.

FRESHTROP FRUITS LIMITED Reg Office: A 603, Shapath IV, S. G. Road, Ahmedabad - 380015 Tel: 079 40307050 | www.freshtrop.com | CIN: L15400GJ1992PLC018365 EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER / YEAR ENDED 31ST MARCH, 2023

BHAGWATI AUTOCAST LIMITED (CIN: L27100GJ1981PLC004718) Regd. Office: Survey No. 816, (New Survey No. 259), Village: Rajoda, Nr. Bavla, Dist. Ahmedabad - 382 220. Ph. +91 2714-232283 / 232983 / 232066. E-mail: cs@bhagwati.com Statement of Audited Financial results for the quarter and year ended 31st March 2023

ભગવતી ઓટોકાસ્ટ લિમિટેડ (CIN: L27100GJ1981PLC004718) રજી. ઓફિસ: સર્વે નંબર ૮૧૬, ગામ: રાજોડા, ગાવળા નજીક, સમજિવાદ-૩૮૨૨૨૦, ગુજરાત, ભારત. ફોન: +૯૧ ૨૭૧૪ ૨૩૨૨૮૩/૨૩૨૯૮૩/૨૩૨૦૬૬ E-mail: cs@bhagwati.com Website: www.bhagwati.com શેરહોલ્ડરોને જાણ કરવા માટેની પોસ્ટલ બેલેટ નોટિસ અંગેની માહિતી

RIDDHI CORPORATE SERVICES LIMITED Regd. Office : 10, Mill Officers Colony, Behind Old RBL, Ashram Road, Ahmedabad - 380009. Phone : (079) 26580767 Web : www.riddhicorporate.co.in E-Mail : Investor@rcspl.net EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED ON 31TH MARCH, 2023

Table with 6 columns: Sr. No., Particulars, Quarter ended on 31/03/2023 (Audited), Quarter ended on 31/12/2022 (Unaudited), Quarter ended on 31/03/2022 (Audited), Year ended on 31/03/2023 (Audited), Year ended on 31/03/2022 (Audited)

APOLLO GUJARAT APOLLO INDUSTRIES LTD. CIN No. L45202GJ1986PLC009042. Web: www.apollo.co.in Regd. Off: Block No. 486, 487, 488, Mouje Dholasan, Taluka & District: Mehsana-382732. Corp. Off: 'Parishram', 5-B, Rashmi Society, Nr. Mithakhali Six Road, Navrangpura, Ahmedabad-380009. EXTRACT OF THE STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED ON MARCH 31, 2023

Table with 6 columns: Sr No., Particulars, Standalone Quarter Ended 31.03.2023, Standalone Year Ended 31.03.2022, Consolidated Quarter Ended 31.03.2023, Consolidated Year Ended 31.03.2022

ase® Ambalal Sarabhai Enterprises Limited® CIN: L5200GJ1978PLC003159 Regd. Office: Shanti Sadan, Mirzapur Road, Ahmedabad - 380001 Phone : 079-25507671, 25507073 | Website: www.ase.life | E-mail: ase@sarabhai.co.in EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2023

Table with 5 columns: Sr. No., Particulars, Quarter ended 31.03.2023, Quarter ended 31.03.2022, Year ended 31.03.2023, Year ended 31.03.2022